



I B Patel English School (Primary)

2020 -2021

Class - 8

Exercises -1

Subject – Gujarati

Chapter : 1 (રેલવે સ્ટેશન)

અભ્યાસ

ચિત્ર જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે?

જવાબ. ચિત્રમાં ટિકિટ ચેકર, મુસાફરો, ફૂલી અને ફેરિયા નજરે પડે છે.

૨. ક્યા ક્યા સ્ટોલ નજરે પડે છે ?

જવાબ. ચિત્રમાં ચાનો સ્ટોલ અને બુકનો સ્ટોલ નજરે પડે છે.

૩. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?

જવાબ. ઘડિયાળમાં ચાર વાગીને ચાલીસ મિનિટ થઈ છે.

૪. ક્યા ક્યા ફેરિયાઓ નજરે પડે છે?

જવાબ. રેલવે સ્ટેશનમાં મીઠાઈવાળો અને ફળવાળો એમ બે ફેરિયા નજરે પાડે છે.

સ્વાધ્યાય

૧. તમે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ગયાજ હશો. તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

૧. ક્યા ક્યા સ્ટોલ જોવા મળે છે?

જવાબ. રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં ચા, પુસ્તક, ફળ, નાસ્તો વગેરેના સ્ટોલ જોવા મળે છે.

૨. કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે?

જવાબ. રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં નીચે મુજબની સૂચનાઓ લખેલી હોય છે.

- સ્વચ્છતા જાળવો.
- કચરો કચરાપેટીમાં જ નાખો.
- ખિસ્સાકાતરુથી સાવધાન રહો.
- શાંતિ જાળવો.
- ટિકિટ માટે લાઈનમાં ઊભા રહો.
- જ્યાં ત્યાં થૂંકો નહિ.
- ધૂમ્રપાન કરવું નહિ .

૩. ક્યા ક્યા વિભાગ અને બારીઓ હોઈ છે?

જવાબ . રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ વિભાગ, પ્રતિક્ષા વિભાગ, કર્મચારી વિભાગ, શૌચાલય વિભાગ વગેરે વિભાગ હોય છે.

જ્યારે ટિકિટ, પૂછપરછ અને રિઝર્વેશનની બારી હોય છે.

બસ સ્ટેશનમાં ઉપહાર વિભાગ, કર્મચારી વિભાગ, શૌચાલય વિભાગ હોય છે. જ્યારે ટિકિટ, પૂછપરછ અને રિઝર્વેશનની બારી હોય છે.

૪. લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે?

જવાબ. લાઉડસ્પીકર દ્વારા સ્ટેશન પર આવનારી બસ અને રેલગાડીના સમય વિશેની સૂચના, બસ કે રેલગાડી આવે કે ઉપડે ત્યારે તેના સ્થળથી થોડા દૂર રહેવું, સ્વચ્છતા રાખવી, અજાણ્યા માલ-સામાનને અડવું નહિ; પોતાનો માલ-સમાન સાચવીને રાખવો વગેરે સૂચનાઓ અપાતી હોઈ છે.

૫. કયા કયા ફેરિયાઓ જોવા મળે છે?

જવાબ. રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં ફળવાળો, સીંગદાણા-ચોકલેટ-બિસ્કિટવાળો, પાણીના પાઉચવાળો, ઠંડાપીણાવાળો વગેરે ફેરિયાઓ જોવા મળે છે.

૬. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો?

જવાબ. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા નીચે મુજબના પગલાંઓ અનુસરી શકાય.

- જ્યાં ત્યાં થૂંકી ગંદકી ના કરવી.
- શોઉચાલયનો ઉપયોગ કરવો.
- ધૂમ્રપાન કરવું નહિ.
- કચરો કચરાપેટીમાં જ નાંખવો.
- પ્લાસ્ટિકની થેલીઓ નો ઉપયોગ ટાળવો.
- ફળની છાલ કચરાપેટીમાં નાંખવી.

૨. નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરો:

૧. શાળા :

- * સ્વચ્છતા જાળવો.
- * કચરાપેટીનો ઉપયોગ કરો,
- * શાંતિ જાળવો.
- * લાઈનમાં ચાલો.
- * પાણીનો બગાડ ના કરો.
- * ફૂલ-છોડનું જતન કરો.

૨. દૂધમંડળી:

- * સમયસર દૂધ જમા કરાવવું.
- * દૈનિક નોંધપોથી સાથે લાવવી.
- * સ્વચ્છ વાસણમાં જ દૂધ લાવવું.
- * સ્વચ્છતા જાળવવી.

* શાંતિ જાળવવી.

૩. આરોગ્ય કેન્દ્ર(દવાખાનું)

* બે બાળકો બસ.

* નિયત સમયે બાળકોને રસી મૂકવો.

* ઓછા બાળ, જય ગોપાળ.

*માતાનું દૂધ સંપૂર્ણ આહાર છે.

* પાણી ગાળીને પીઓ.

* શાંતિ જાળવો.

* સંમતીપત્રકમાં સહી કરતા પહેલા સંપૂર્ણ લખાણ વાંચો.

૪. ગ્રામપંચાયત

* જન્મ અને મરણની નોંધ એકવીસ દિવસમાં કરાવી લેવી. પંદર દિવસ બાદ એ અંગેનું પ્રામાણપત્ર મેળવી લેવું.

* ઘરવેરો, પાણીવેરો અને જમીનવેરો નિયમિત ભરો.

* નિરક્ષરતા, અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો અને કુસંપ દૂર કરો.

* વૃક્ષો ઊછેરો. વૃક્ષો વાવો. પર્યાવરણનું જતન કરો.

* ૭-૧૨ અને ૮ - 'અ' ના જમીન ઉતારાની નકલ તલાટી પાસેથી તરત મેળવી શકાશે.

* ગ્રામશભામાં હાજરી અવશ્ય આપો.

* ગામમાં સામાજિક સમરસતા અને પારિવારિક ભાવના જાળવવી એ દરેક ગ્રામવાસીની ફરજ છે.

૫. બસ-સ્ટેશન:

* ખિસ્સાકાતરુથી સાવધાન રહો.

* થુંકવા માટે થુંકદનીનો ઉપયોગ કરવો

* કચરો કચરાપેટીમાં જ નાંખવો.

* તમારી ફરિયાદ લખીને ફરિયાદપેટીમાં નાખો.

* બિનવારસી ચીજવસ્તુને અડવું નહિ. કાર્યાલયમાં જાણ કરવી.

૩. ઉદાહરણ મુજબ શબ્દ બનાવો: રેલવે-રેલવે સ્ટેશન

બસ- બસ સ્ટેશન

જહાજ - બંદર

विमान - विमानमथक

रिक्सा - रिक्सा-स्टेन्ड

डेलिकोप्टर - डेलिपेड